

June 6, 2019

E-FILING

To

1. The Manager,
Corporate Relationship Dept.,
BSE LIMITED,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
MUMBAI – 400 001

2. The Manager, Listing Department,
NATIONAL STOCK EXCHANGE OF INDIA LTD.,
"Exchange Plaza", C-1, Block-"G",
Bandra-Kurla Complex, Bandra (E),
MUMBAI – 400 051

Script Code : 526725

NSE Symbol : SANDESH (EQ.)

Dear Sir / Madam,

Sub: Intimation to Stock Exchange regarding sending of reminder letters and publication of notice with respect to transfer of Equity Shares to Investor Education and Protection Fund Authority

We hereby inform you that pursuant to provisions of Section 124 of the Companies Act, 2013 read with Investor Education and Protection Fund (Accounting, Audit, Transfer and Refund) Rules, 2018, as amended (hereinafter referred to as 'the Rules'), the Company has issued individual reminder letters to shareholders whose dividend has not been paid or claimed for seven consecutive years or more and whose shares are liable to be transferred to Investor Education Protection Fund Authority ("IEPF Authority"). In regard to this and in compliance with the Rules the Company has also published notices in the newspapers for drawing the attention of the shareholders.

Hence, pursuant to Regulation 30 and Regulation 47 read with Schedule III of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended, please find enclosed herewith the following:


1. Copy of the reminder letter dated June 5, 2019 sent to shareholders.
2. Copies of notices published by the Company on June 6, 2019, in the newspapers "Indian Express" (English Newspaper) and "Sandesh" (Gujarati Newspaper) for the attention of the Equity Shareholders with respect to transfer of Equity Shares of the Company to IEPF Authority.

The aforesaid newspaper notices are also uploaded on the website of the Company. i.e. www.sandesh.com

Kindly take the same on your records.

Thanking you,

Yours sincerely,
FOR THE SANDESH LIMITED


DHAVAL PANDYA
COMPANY SECRETARY



Encl.: As above

THE SANDESH LIMITED (CIN : L22121GJ1943PLC000183)

REGD. OFFICE : SANDESH BHAVAN, LAD SOCIETY ROAD, B/H. VASTRAPUR GAM, P.O. BODAKDEV, AHMEDABAD-380 054.
PHONE : (079) 40004319, 40004175, FAX NO. 91-079-40004242. E-mail : secretarial@sandesh.com, cs@sandesh.com
VISIT US : WWW.SANDESH.COM

June 5, 2019

SPEED POST

To,

Sub.: Transfer of Equity Shares to Investor Education and Protection Fund (IEPF)

Ref.: Folio Number / Client ID DP ID:

Dear Sir / Madam,

This is to intimate that pursuant to the provisions of Section 124 of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended ("Rules") the Company is required to transfer all shares in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more, in favor of Investor Education and Protection Fund Authority (IEPF Authority).

As per our records the dividend declared for the consecutive period of seven years in respect of your shares is lying unpaid / unclaimed with us. The details of the dividends lying unpaid / unclaimed are uploaded on our website www.sandesh.com. You are requested to claim your unpaid / unclaimed dividend lying unpaid / unclaimed for seven consecutive years **latest by September 30, 2019** by submitting at the Company's Registered office address (as mentioned at the end), the claim letter duly signed in the format enclosed herewith at **Annexure-1** and in case the original demand drafts are lost / misplaced you are also required to execute an indemnity on a stamp paper of Rs. 100/- in the format enclosed herewith at **Annexure-2**.

In absence of any claim latest by **September 30, 2019**, the Company shall initiate necessary steps to transfer the shares held in your name to IEPF Authority, without further notice and in accordance with the Rules within 30 days from **September 30, 2019**.

In case the shares are held by you in demat form, the Company shall inform the depository by way of corporate action for transfer of shares lying in your demat account to IEPF Authority. In case the shares held in physical form, the Company would be issuing new share certificate(s) in lieu of the original share certificate(s) held by you for the purpose of dematerialization and transfer of shares to IEPF Authority as per Rules and upon such issue, the original share certificate(s) which stand registered in your name will stand automatically cancelled and be deemed non – negotiable. **Please note that no claim shall lie against the Company in respect of the shares so transferred to IEPF.**

You may note that both the unpaid / unclaimed dividend and the shares transferred to IEPF Authority can be claimed back from IEPF Authority after making an online application in the form IEPF 5 available on the website of IEPF (www.iepf.gov.in) and Company (www.sandesh.com) and sending a physical copy of the same duly signed alongwith the requisite documents enumerated in the form IEPF 5 to the Company at its registered office.

In case of any query you may write to the Company at its Registered Office situated addressing to The Secretarial Department, Sandesh Bhavan, Lad Society Road, B/h. Vastrapur Gam, P.O. Bodakdev, Ahmedabad – 380054 or call on Tel.: (079)-40004319/358 or send email at cs@sandesh.com or contact the Company's Registrar and Share Transfer Agent viz. MCS Share Transfer Agent Limited at its Regional office at 201, Shatdal Complex, 2nd Floor, Ashram Road, Ahmedabad – 380009 Tel.: (079) 26580461 / 62 / 63 Fax No.: (079) 26581296 Email ID: mcssta@rediffmail.com, mcsahmd@gmail.com.

Thanking you,

Yours faithfully,

For, THE SANDESH LIMITED

DHAVAL PANDYA

COMPANY SECRETARY

ENCL.: As Above

Note: This is a computer generated letter and hence no signatures are attested.

Annexure - 1

CLAIM LETTER

Date: _____, 2019

To,
SECRETARIAL DEPARTMENT
THE SANDESH LIMITED
'Sandesh Bhavan', Lad Society Road,
B/h. Vastrapur Gam, P.O. Bodakdev,
Ahmedabad-380054 (Gujarat-India)

Sub.: Request letter for claiming the unpaid dividend.

Ref.: Folio No. / Client ID DP ID: _____

Dear Sir / Madam,

In response to your letter dated **June 5, 2019**, I/We, _____ (name of Shareholder(s)) holding _____ Equity shares through Folio No. / Client ID DP ID _____ in your Company, hereby request to claim the dividend lying unpaid / unclaimed for the consecutive period of seven years in respect of my shares. For this purpose kindly find enclosed herewith self-attested PAN Card copy and Aadhar Card Copy.

For processing the payment of dividend I wish to opt for the following mode:

(Put a tick against any one)

Revalidation of Demand Drafts	
NEFT / NECS *	

Please note my/our bank details for effecting transfer of dividend amount through NEFT / NECS into my/our bank account:

1. Account No.: _____
2. Name of Bank: _____
3. Name of Branch and address of Bank: _____
4. IFSC Code: _____

**(Enclosing of cancelled cheque leaf is mandatory)*

I/We, hereby declare that the original demand drafts issued by the Company are lost / misplaced by me/us and for which I/we have executed the indemnity on a stamp paper of Rs. 100/- and the same is enclosed herewith. **

OR

I/We, hereby surrender the original demand drafts issued by the Company for cancellation for claiming the dividend by issuance of duplicate demand drafts / through direct credit into my bank account. **

*** (Strike out whichever is not applicable)*

Request you to kindly do the needful.

Thanking you,

Yours sincerely,

Name & Signature of
Shareholder(s)

:

First Shareholder

Second Shareholder

Third Shareholder

Annexure – 2

INDEMNITY
(On stamp paper of Rs. 100/-)

Date: _____

To,
Secretarial Department,
THE SANDESH LIMITED
"Sandesh Bhavan", Lad Society Road,
B/h. Vastrapur Gam, P.O. Bodakdev,
Ahmedabad-380054 (Gujarat-India)

Dear Sir,

Sub: Indemnity for Issue of Duplicate Dividend Warrant(s) / Direct Credit of Dividend Amount into my/our Bank Account

I/We, _____ son of/ wife of / daughter of _____ (hereinafter called as "Applicant(s)") residing at _____ who is/was/are/were holding _____ Equity shares under Folio No./ DP ID/ Client ID _____, in M/s. **The Sandesh Limited** (hereinafter referred to as the "Company") hereby request you to issue us/me the Duplicate Dividend warrant(s)/draft(s) or directly credit the Dividend Amount into my/our Bank Account for the Financial Year from _____ to _____ in lieu of the following original Dividend warrant(s)/drafts(s) which is/are lost / misplaced / not traceable and have not been encashed by us/me:-

Dividend due on / [Financial Year(s)]	Warrant No. / Demand Draft No.	Dividend Amount (Rs.)

In case, at a later date, if it is proved that the amount(s) has/have been realized/credited to my/our account earlier, I/we hereby for myself/ ourselves, my/our heir(s), executor(s), administrator(s) and assignee(s) do hereby jointly and severally covenant with the Company, agree to indemnify and to pay the legal fees to the Company against all claims, damages, costs, losses, charges, demands and expenses which may be made against or suffered or incurred by the Company by reason of and in consequence of such issue of Duplicate Dividend Warrant(s)/ Draft(s) or direct credit of dividend account into my/our Bank Account or otherwise howsoever in relation thereto.

I/We hereby unconditionally and irrevocably submit to the exclusive jurisdiction of the Competent Forum / Court in Ahmedabad with regard to any question or matter arising out of this undertaking and/or any other documents that may be executed by me/us or any of us in pursuance hereof arising therefrom.

I/We undertake to surrender the said original dividend warrant(s) / draft(s) to the Company for cancellation, if and when the same is/are found at a later date.

I/We solemnly affirm and declare that whatever stated hereinabove is true and correct to the best of my/our knowledge and belief.

Name, Address & Signature of Shareholder(s) : _____
First Shareholder Second Shareholder Third Shareholder

Name, Address & Signature of Witness:

(PAN Card and Aadhar Card required for witness)



People offer prayers at the Shri Sorathiya Brahmakshatriya Trust hall in Ahmedabad on the occasion of Eid-ul-Fitr on Wednesday. *Javed Raja*

Hindu trust offers space for namaz

SURESH CHAUDHARY
AHMEDABAD, JUNE 5

FOR THE past 24 years, a Hindu trust in Kankaria area of Ahmedabad has been offering a space of worship to Muslim devotees on Eid-ul-Fitr.

Hundreds of devotees usually visit the Idgah mosque that opens just twice a year—during Eid-ul-Fitr and Eid-ul-Adha (Bakrid). Many of them will be left with no space within the premises and offer namaz on the streets. The Shri Sorathiya Brahmakshatriya Trust has been offering their marriage hall for them on these days.

Owned by the Gujarati Brahmin community, the trust managers claim that their gates are always open for their Muslim brothers.

"The hall was made for marriages and other ceremonial occasions in the community. But since its inception in 1995, we have always welcomed our brothers," said Rajendrabhai Bosaniya, secretary of the Shri Sorathiya Brahmakshatriya Trust. "They need the space for hardly an hour or two. We live in total harmony and try to help them in whatever way we can."

The trust declines bookings during Ramzan and Bakrid and

even offers water for the devotees to drink and wash their hands and feet before the namaz.

"I have been offering namaz at this place for more than a decade now. Our Hindu brothers have always been very cooperative," said Ferozibhai Malik, who runs a garage just in front of the masjid. "We are also thankful to the police who provide us the security that lets us offer our prayers in peace."

Another devotee, Sarvar Sheikh, said he comes from Paldi every year to offer his prayers at the mosque.

(Suresh Chaudhary is an intern with The Indian Express)

DROUGHT DECLARATION CERTIFICATE RENEWAL

Midday Meal scheme hits roadblock

PARIMAL DABHI
GANDHINAGAR, JUNE 5

THE STATE-RUN Midday Meal (MDM) scheme, which the government had declared to continue in 51 tehsils of Gujarat reeling under drought, even during summer vacations in schools, had been discontinued from June 1. This, as Revenue Department has reportedly not renewed the Drought Declaration Certificate (DDC), effective till May 31, for the 51 talukas in 11 districts.

The Revenue Department had issued the Drought Declaration Certificate on October 30, 2018, while declaring moderate/severe drought in 51 tehsils of Ahmedabad, Banaskantha, Bhavnagar, Devbhumi Dwarka, Jamnagar, Kutch, Mehsana, Morbi, Patan, Rajkot and Surendranagar districts. Five of the 51 tehsils—Suigam in Banaskantha, Lakhpata and Abdasa in Kutch, Maliana in Morbi and Shankeshwar in Patan—were declared to be severely affected by the drought.

The certificate, a copy of which is with The Indian Express, stated, "The declaration of drought would come into effect on 1st December 2018 and

would continue to be in effect for six months from this date unless revoked earlier by an order of the state government."

Following this, a range of relief initiatives were started by the state government in the 51 tehsils. And one of them was to continue the MDM scheme in schools of those tehsils even during the summer vacation.

However, since the drought certificate "expired" on May 31, office of the Commissioner, MDM Scheme, issued a circular the same day addressing the Collector Office of those 11 drought affected districts.

The circular (in Gujarati), ac-

cessed by The Indian Express, stated that the Gujarat government had declared 51 tehsils of 11 districts as drought-affected between December 1, 2018, and May 31, 2019. And accordingly, MDM Scheme and Doodh Sanjeevani Yojna (under which fortified milk is provided to children) were continued in the schools of those 51 tehsils during summer vacation as per the guidelines of the Supreme Court.

"At present, since no instruction has been received from the Revenue Department to extend the DDC, from June 1, 2019, benefits under (the) MDM Scheme and Doodh Sanjeevani Yojana in

the above mentioned 51 tehsils will have to be stopped from June 1, 2019...Between June 1, 2019 and June 9, 2019, no expense shall be incurred on MDM Scheme and Doodh Sanjeevani Yojna," read the circular.

Incharge commissioner of MDM Scheme in Gujarat, J D Desai said the drought notification of Revenue Department expired on May 31, 2019. "After that they have not extended the notification..."

"The MDM scheme will be continued from June 10 when the schools reopen (after summer vacation)," Desai added. Revenue Minister Kaushik

Patel could not be contacted despite repeated attempts.

Whereas, when asked if the declaration of drought in 51 tehsils was renewed after May 31, Additional Chief Secretary of Revenue Department, Pankaj Kumar, said, "All activities that we were doing, are being continued."

Kumar, however, could not reply to queries on discontinuance of the MDM Scheme in the schools of these 51 drought-affected tehsils during summer vacation. He said he was in a crowded place and the audio was not clear. He could not be contacted thereafter.

Dalits demand panel to probe corruption in panchayat after murder of RTI activist, son

EXPRESS NEWS SERVICE
RAJKOT, JUNE 5

TWO WEEKS after a Dalit teen was allegedly clubbed to death by a group of upper-caste Kshatriya men, the community in Manekevada village of Kotda Sanaganj taluka in Rajkot district on Wednesday submitted a memorandum to the mamlatdar, demanding strictest punishment to the accused and a committee to look into the allegations of corruption in the panchayat.

The Dalit delegation was led by Meghabhai Sondarva, grandfather of Rajesh (19) who was allegedly murdered on May 22. "Through this memorandum, we demand that those accused of murdering Nanjibhai and his son be given the strictest punishments. The accused are the same persons who are indulging in corruption and spreading terror in the village. Therefore, through your office, we convey to the state government that they should not be released on bail either," the Dalits stated in the memorandum.

Rajesh was allegedly intercepted by the group of men from Kshatriya community near Manekevada village while he was on his way back from Rajkot city and beaten to death. Criminal Investigation Department (CID)-Crime, which is investigating Rajesh's murder, said that the teenager was killed by the Kshatriyas as he was trying to get the bail of one of his father's alleged killers cancelled.

On March 9, 2018, his father Nanji was also allegedly murdered after he alleged corruption in development projects and filed RTI applications, seeking details of the projects, demanding that criminal cases be filed against a few Kshatriyas of the village. "Nanji, without caring for his life, fought till his last breath to expose these corrupts and corruption in the village. We demand that a committee be set up to investigate this corruption," stated the memorandum. The CID-crime has so far arrested eight persons in connection with Rajesh's murder - two of them are accused in Nanji's murder also.

The Dalits also demanded all due government benefits to the victim's family and sufficient police protection. "Additionally, even today, anti-social persons are roaming freely in the village. They are not afraid of the law of the land and indulge in anti-social activities almost daily. We urge your office to teach such persons lessons," the Dalits further demanded through the memorandum.

Incidentally, Rajesh's family had refused to claim his body, demanding government provide them residential plot at some other village and enough police protection. It was only after the resident additional collector of Rajkot gave the family a written assurance that they would be allotted a residential plot in Pardi village that they had claimed the victim's body.

PEGASUS ASSETS RECONSTRUCTION PRIVATE LTD.
55-56, 5th Floor, Free Press House, Nariman Point, Mumbai-400 021.
Phone No. : (022) 6188 4700 Fax : (022) 2284 6797.
Email : sys@pegasus-arc.com URL : www.pegasus-arc.com

POSSESSION NOTICE (RULES 8 (1))

Pursuant to the Demand Notice dated 25/07/2018 issued by the Authorised Officer of Insudnt Bank Limited u/s 13 (2) of The Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (SARFAESI Act) calling upon the borrower **Ms. Lajo Fashions Pvt. Ltd., Mr. Rajesh Mangilal Jain and Ms. Kokila Ganeshlal Jain** to repay the amount mentioned in the notice being Rs. 53,87,393.23/- (Rupees Fifty Three Lakhs Eighty Seven Thousand Three Hundred Ninety Three and Paise Twenty Three Only) as on 06/07/2018 with further interest at the contractual rate and costs, charges and expenses within 60 days from the date of receipt of the said notice.

Dues of the said borrower along with underlying security interest was assigned in favor of Pegasus Assets Reconstruction Pvt. Ltd. acting in its capacity as Trustee of Pegasus Group One Trust 32 (Pegasus) by Insudnt Bank Limited vide Assignment Agreement Registered on 14/03/19 under the provisions of SARFAESI Act.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13 (4) of the said Act, read with Rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this 31/05/2019.

The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Pegasus for an amount of Rs. 53,87,393.23/- (Rupees Fifty Three Lakhs Eighty Seven Thousand Three Hundred Ninety Three and Paise Twenty Three Only) as on 06/07/2018 with further interest at the contractual rate and costs, charges and expenses.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of Immovable Property

- All that piece and parcel of Shop No. L9 measuring 394.00 sq. fts. Equivalent to 36.60 sq. mts. on Lower Ground Floor together with undivided proportionate share in underneath land of "Heera Panna Shopping Mall", constructed on the land bearing Plot Nos. 2, 3 and 6 of F.P. No. 173, T.P. Scheme No. 4 (Umra-South), Revenue Survey No. 144/1 part of Village Umra, City Surat
- All that piece and parcel of Shop No. L10 measuring 394.00 sq. fts. Equivalent to 36.60 sq. mts. on Lower Ground Floor together with undivided proportionate share in underneath land of "Heera Panna Shopping Mall", constructed on the land bearing Plot Nos. 2, 3 and 6 of F.P. No. 173, T.P. Scheme No. 4 (Umra-South), Revenue Survey No. 144/1 part of Village Umra, City Surat

Bounded: On the North by: Parking, On the South by: Passage, On the East by: Shop No. 11, On the West by: Shop No. 8B

Sd/-
Authorised Officer
Pegasus Assets Reconstruction Private Limited
(Acting in its capacity as the Trustee of
Pegasus Group One Trust 32)

Place : Surat
Date : 31/05/2019

PEGASUS ASSETS RECONSTRUCTION PRIVATE LTD.
55-56, 5th Floor, Free Press House, Nariman Point, Mumbai-400 021.
Phone No. : (022) 6188 4700 Fax : (022) 2284 6797.
Email : sys@pegasus-arc.com URL : www.pegasus-arc.com

POSSESSION NOTICE (RULES 8 (1))

Pursuant to the Demand Notice dated 25/07/2018 issued by the Authorised Officer of Insudnt Bank Limited u/s 13 (2) of The Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (SARFAESI Act) calling upon the borrower **Mr. Rajesh Mangilal Jain, Ms. Kokila Ganeshlal Jain and Ms. Lajo Fashions Pvt. Ltd.** to repay the amount mentioned in the notice being Rs. 1,37,41,669.99/- (Rupees One Crore Thirty Seven Lakhs Forty One Thousand Six Hundred Sixty Nine and Paise Ninety Nine Only) as on 06/07/2018 with further interest at the contractual rate and costs, charges and expenses within 60 days from the date of receipt of the said notice.

Dues of the said borrower along with underlying security interest was assigned in favor of Pegasus Assets Reconstruction Pvt. Ltd. acting in its capacity as Trustee of Pegasus Group One Trust 32 (Pegasus) by Insudnt Bank Limited vide Assignment Agreement Registered on 14/03/19 under the provisions of SARFAESI Act.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13 (4) of the said Act, read with Rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this 31/05/2019.

The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Pegasus for an amount of Rs. 1,37,41,669.99/- (Rupees One Crore Thirty Seven Lakhs Forty One Thousand Six Hundred Sixty Nine and Paise Ninety Nine Only) as on 06/07/2018 with further interest at the contractual rate and costs, charges and expenses.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of Immovable Property

- All that piece and parcel of Shop No. 1201 measuring about 170 sq. ft. equivalent to 15/80 sq. mtrs on Ground Floor together with undivided share underneath land measuring about 7.00 sq. mtrs of "C" wing of "Raghukul Market" constructed on the land bearing Revenue Survey No. 57/1+2+3, T.P. Scheme No. 7 (Anjana), Final Plot No. 91, 92, 93 at Village: Anjana, Tal: Choryasi, Dist: Surat.
- All that piece and parcel of Shop No. 1318 measuring about 170 sq. ft. equivalent to 15/80 sq. mtrs on Ground Floor together with undivided share underneath land measuring about 7.00 sq. mtrs of "C" wing of "Raghukul Market" constructed on the land bearing Revenue Survey No. 57/1+2+3, T.P. Scheme No. 7 (Anjana), Final Plot No. 91, 92, 93 at Village: Anjana, Tal: Choryasi, Dist: Surat.

Bounded: On the North by: Shop No. 1201A, On the South by: Shop No. 1202, On the East by: Passage, On the West by: Passage

Sd/-
Authorised Officer
Pegasus Assets Reconstruction Private Limited
(Acting in its capacity as the Trustee of
Pegasus Group One Trust 32)

Place : Surat
Date : 31/05/2019

EXPRESS Careers

RASHTRASANTUKADOJI MAHARAJ NAGPUR UNIVERSITY, NAGPUR
No. RTMNU/GA/530 EMPLOYMENT NOTICE Date: 1st June, 2019
Applications are invited in the prescribed format from eligible candidates for the post (02 posts) of ASSISTANT PROFESSOR (Subject : LAW) in Rashtrasantukadoji Maharaj Nagpur University's Dr. Babasaheb Ambedkar College of Law, Nagpur. The prescribed application form is available on the Website of the University www.nagpuruniversity.org
The application form alongwith self-attested true copies of the relevant documents/ certificates in ELEVEN SETS is to be submitted on or before 2nd July, 2019.
(Dr. VINAYAK S. DESHPANDE)
Registrar (Officiating)

भारतीय रिज़र्व बैंक
RESERVE BANK OF INDIA
www.rbi.org.in

RECRUITMENT FOR THE POST OF DIRECTOR, CAFRAL

The Search Committee for selection of Director for Centre for Advanced Financial Research and Learning (CAFRAL) invites applications from accomplished academic-administrators and researchers for the post of Director, CAFRAL, located at Mumbai, India. Tenure of appointment would be five years with mid-term review of performance and feedback; and may be extended, if necessary. The maximum age of the candidate shall not be more than 70 years at the time of appointment, extendable up to 75 years in case of extension of the term. The other terms and conditions of appointment and format for submitting Curriculum Vitae have been detailed in the advertisement placed on the websites of RBI (www.rbi.org.in) and CAFRAL (www.cafral.org.in). Applications together with a detailed Curriculum Vitae (in the prescribed format) may be sent to CAFRAL Search Committee c/o Corporate Strategy & Budget Department, Central Office, Reserve Bank of India, Main Building, 2nd floor, Shahid Bhagat Singh Road, Mumbai-400001 or emailed to searchcafral2019@rbi.org.in, not later than 4:00 PM (IST) on July 05, 2019. The Search Committee reserves the right to fill up the position by invitation.

INSTITUTE OF HOTEL MANAGEMENT, CATERING TECHNOLOGY & APPLIED NUTRITION,
Veer Savarkar Marg, Dadar, Mumbai - 400 028
(AN AUTONOMOUS BODY UNDER THE MINISTRY OF TOURISM, GOVT. OF INDIA)
Tele no.: 022-24457241 Website : www.ihmctan.edu E-mail: info@ihmctan.edu

TEACHING ASSOCIATE

Applications are invited for filling up 'TEACHING ASSOCIATE' 04 posts (UR - 03 & OBC - 01) on contract basis. For eligibility criteria and other details visit Institute website : www.ihmctan.edu.
Last date for receiving duly filled form with required attachment is 18th June, 2019, 5.00 P.M.
Principal

KITE KNOWLEDGE INSTITUTE OF TECHNOLOGY AND ENGINEERING
Near S.P. University sport complex, Bakrol-Vadlal Road, Bakrol-388315, Anand, Gujarat
A self financed Engineering Institute promoted by MADHAV EDUCATION CHARITABLE TRUST, AICTE Approved and Affiliated to GTU

FACULTY REQUIRED

Applications are invited for the post of Professor / Associate Professor / Assistant Professor and Lab Assistant for the following disciplines.

Sr.No.	Branch	Prof.	Asso.Prof	Asst. Prof.	Lab. Asst.
1	Mechanical Engineering	1	2	2	2
2	Automobile Engineering	1	2	6	2
3	Civil Engineering	1	2	2	2
4	Computer Engineering	1	1	2	1
5	Information Technology	1	2	4	1
6	Electronics Communication	0	0	1	0
7	Mathematics	0	0	3	0
8	English	0	0	1	0
9	MBA	0	0	1	0
10	Physics	0	0	1	0
11	B.Com LLB (Knowledge of Indian Constitution Preferred)	0	0	1	0

Number of Position may vary, if senior positions are not filled.
Qualification, experience and pay scale as per GTU/AICTE norms.
Higher starts may be offered to deserving candidates. Interested candidates may send their application to above mentioned address or E-mail at directorknowledgecampus@gmail.com with detailed resume, copies of testimonials, copy of school leaving certificate, Aadhar card, PAN card and passport size photo on or before 17th June 2019. Applications will not be accepted without copies of testimonials.

SBI CENTRAL RECRUITMENT & PROMOTION DEPARTMENT
CORPORATE CENTRE, MUMBAI, Phone: 022-2282 0427; Fax: 022-2282 0411

Recruitment of Specialist Cadre Officers on Contract Basis for our Wealth Management Business Unit (SBI Wealth)

Applications are invited from Indian citizens for the post of:

Sr. No.	Name of the Post	No. of Vacancy
1	Head (Product, Investments & Research)	1
2	Central Research Team (Fixed Income Research Analyst)	1
3	Relationship Manager	
4	Relationship Manager (e-Wealth)	486
5	Relationship Manager (NRI)	
6	Relationship Manager (Team Lead)	20
7	Customer Relationship Executive	66
8	Zonal Head Sales (Retail) Eastern Zone	1
9	Central Operation Team Support	3
10	Risk & Compliance Officer	1

Eligibility criteria (age, qualification & experience), requisite fees and other details are available under Advertisement No. CRPD/SCO-WEALTH/2019-20/06 on Bank's website <https://bank.sbi/careers> OR <https://www.sbi.co.in/careers> along with a link for online submission of application as well as online payment of application fee. Candidates are advised to go through the detailed advertisement ensuring their eligibility and other details before applying and remitting fees.

Date For Filing Online Application & Payment Of Fees: 23.05.2019 To 12.06.2019.

For any query, please write to us through link "CONTACT US" → "Post Your Query" which is available on Bank's website (URL: <https://bank.sbi/careers/psq.htm?action=pquery> OR <https://sbi.co.in/careers/psq.htm?action=pquery>)

Place: Mumbai | Date: 23.05.2019
General Manager (CRPD)

THE ODISHA MINING CORPORATION LIMITED
OMC House, Bhubaneswar-751001, Odisha
CIN : U13100OR1956SGC000313, www.omctd.in

No.27/OMC ADVERTISEMENT FOR RECRUITMENT OF EXECUTIVES IN OMC LTD.

The OMC, a Gold category and largest State PSU in Mining Sector in the Country, undertakes exploration, mining and trading of iron, chrome & bauxite ores. Inspired by the vision to emerge as the market leader and to play a catalytic role in the growth of industrialization, OMC caters to the requirements of mineral based industries with an annual turnover of Rs.4053 Crores during Financial Year 2018-19.

The Corporation invites application from dynamic & competent professionals in different discipline as follows.

1. VACANCY :-

Sl. No.	Name of the Post & Grade	Scale of Pay	Category of Posts				Total Posts
			SC	ST	SEBC	UR	
1	Manager (Personl.) E-3 Grade	Rs.67,700/- to 2,08,700/-	1	1	1	-	3
2	Dy. General Manager (Fin.), E-5 Grade	Rs.78,800/- to 2,09,200/-	-	-	-	1	1
3	Dy. General Manager (Fin.), E-2 Grade	Rs.67,700/- to 2,08,700/-	1	-	-	1	2
Total			2	1	1	2	6

Interested eligible candidates are required to download the application format from OMC website : www.omctd.in and submit the same duly filled in & signed along with self-attested copy of mark-sheets and certificates, documents from HSC onwards towards proof of qualification, age, experience in support of their eligibility by Speed Post / Courier in a cover superscribed "APPLICATION FOR THE POST OF _____" so as to reach the General Manager (P&A), The Odisha Mining Corporation Ltd., OMC House, Bhubaneswar-751001 by 29.06.2019 positively. Applications received after the last date due to delay in postal/courier or any other reason shall not be entertained and will be rejected.

The OMC Management reserves the right to cancel, amend or alter the above advertisement without assigning any reason thereof.

Sd/-
Director (Personnel)

